

॥ तस्य वाचकः पणवः ॥

# ऋतम्-भरा

आत्मनो हिताय जगातः सुखाय



'योग' लिखा लावीओ, 'लिखू' जनी गुरुद्वार;  
मुमुक्षु ज़र पामशे, सौनो मुजमां भाग।

## \* નિમંત્રણ-પત્રિઠા \*

ઓમ્પરમાત્માની કૃપાથી અને પુ. શુરુદેવના આગિયથી શુરુપૂર્ણિમા મહેાત્સવ ઉજવવાનું નિ  
ક્ર. સત્સંગ-બળના કાર્યક્રમનો લાભ દેવા સીને હાર્ડિક નિમંત્રણ છે.

કલ્યાણપદ્ધતા પદ્ધિકોને કલ્યાણના કાર્યક્રમનો લાભ દેવા જવા માટે આમંત્રણ-નિમંત્ર  
જરૂરત હોતી નથી.

સમય : ૧૪-૭-૬૨ મંગળવાર, સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ કલાક.

સ્થળ : ઈચ્છાબેનની વાડી, શેલતલુલા, મહીનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

-: શુરુનિષ્ઠા :-

સીતાલુ, લાખ-લાખ ઇપિયાના ઇમતવાળા મોતીની માળા ઉનુમાનણુને પહેરાને છે તુ  
હનુમાનણુ એક એક મોતીને ડાંતથી તોડી-તોડીને રોમાં જુઓ છે કે આમાં મારા રામ છે? :  
વિનાનું મોતી લાખનું કે કરોડ ઇપિયાનું હોય તોય તેમના મનથી તે કથીર સમાન છે. આ દષ્ટાંત ર  
ઉનુમાનણુની રામનિષ્ઠા ડર્યોવવાનો પ્રયત્ન થયો છે. આ દષ્ટાંતનો વ્યાપક અર્થ આ રીતે સમજુ શકાય

જેને મારા સંત-શુરુ તરફ માન ના હોય, કે મારા શુરુ-સંત માટે વાંકુ બોલતો હોય તે જે  
કદ્યાધિપતિ હોય, કે મોટો મિત્ર-માલીક હોય, કે મોટો પ્રધાન હોય, કે મોટો વિદ્યાન હોય તોય મારે  
કામનો? મારા મનથી તો તે કથીર સમાન છે, તેના માટે તો મને એટલો તિરસ્કાર આવે કે હું તે  
પર થંકું. (ઉનુમાનણુએ મોતીને ડાંતથી તોડ્યા તેનો ગૃદાર્થ તેણો તેના પર થંક્યા એવો થઈ શકતું

જેમણે આંગળી ચીંધીને આપણુને શુરુનો જોણો કરાન્યો હોય તેમનો ખૂબ ખૂબ આલ  
માનીએ, પરંતુ તે પણ ને વિવેક-ભષ્ટ થઈને શુરુણું વાંકુ બોલે તો તેનો પણ ત્યાગ કરતા વ  
ન લગાડીએ. આપણુને અકલ્યાણમાં ફેંકવાનો પ્રયત્ન ને કોઈ કરે તેને તુરત જ ત્યાગી હેવા જેટલી પ  
ને આપણામાં થરનીરતા ના હોય તો આપણું કલ્યાણ શું કોઈ બીજે આવીને કરી હેશો? કઢી નહીં. અસ્તુ

-: સ્વર્ણંદ્રનું ગાંડપણ :-

આજકાલના ચુવાન છોકરા-છોકરીએ સ્વર્ણંદ્ર વર્તેન કરીને પોતાના માતાપિતાને ખૂબ દુલદ  
ક્ર. સ્વર્ણંદ્રાના ગાંડપણમાં એ વાત તેણો સાવ ભૂલી જ જતાં હોય છે કે લવિષ્યમાં પોતાને પદ  
માતાપિતા થવાનું છે; ત્યારે પોતાની પણ તેવી જ ફરા થશે. ભૂત, લવિષ્ય અને વર્તેમાનમાં સુખ-શાંતિ  
પ્રાપ્ત થાય તેવી ધીરજ અને તેવી સમજથી કે કામ હે તે જ સાચી ચુવાની.

# દુતમભરા

(દુતમભરા એટલે અનુભવકુળ સત્ત્વથી ભરેનું)

(અધ્યાત્મિકાય - અધ્યાત્મસુખાય)

APR - MAY - JUNE - 1992-93

Vol - II (92-93)

Issue - I

માનદંની : નેષન્ચ બાસ

## તંત્રી રથાનેથી.....

વાચક મિત્રો,

“દુતમભરા” આઈ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે પ્રકાશનસમિનિ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. અમારો આ આનંદ આપ સૌના સહકારને આભારી છે.

આ નવ વર્ષ દરમાન “દુતમભરા”નો વાચકવર્ગ ખૂબ બહોળો થયો છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક વાચકોનાં સૂચનો મળે છે કે ગુરુતત્ત્વ ઉપર એક અંક પ્રગટ થાય તો સૌને તે વિષય વિપેની ઘણી બધી માહિતી મળે અને સૌની ગુરુતત્ત્વ વિપેની તાત્ત્વિક સમજ વર્ષી.

આમ તો ગુરુતત્ત્વ-પરમ ગુરુતત્ત્વ વિપે સંપૂર્ણપણે રજૂઆત કરવી તે અધ્યક્ષ જ છે અને તેથી શાસ્ત્રોમાં ધારું બધું લખાયા પછી પણ અને તો “નેનિ... નેનિ... નેનિ...” શબ્દપ્રયોગ જ કરવામાં આવે છે. પરંતુ પરમભૂત ઓમ પરમાત્માની અસીમ કૃપાથી નથી. પ.૫. ગુરુદેવ શ્રી યોગભિકુઞ્ચનાં આશીર્વયનો-ઉપદેશો-પ્રવચનોમાંથી ગુરુતત્ત્વ વિપેના જે તાત્ત્વિક અંશો પ્રાપ થાય તેનું સંકરન કરી અહીં રજૂ કરવાનો પ્રવલ કરાયો છે.

“દુતમભરા” (પરિવારપત્રિકા)ના વર્ષ-૧ અંક-૨માં આ બધી વાતો રજૂ કરી હતી. વર્ષ-૧ અંક-૩,૪માં ધ્યાન અને મંત્ર વિપેની રજૂઆત કરી હતી. છેલ્લા થોડું વધોથી આ સામયિકના સત્ત્વ અનેથ વાચકોનાં સૂચનો ઉપર વિચાર કરીને પ્રકાશનસમિનિએ એવો નિર્ણય કર્યો છે કે ઉપરોક્ત વાટ અંકોમાંનું સાહિત્ય, આ અંક અને હવે પછીના જે અંકમાં પ્રગટ કરવાનો પ્રવલ કરવામાં આવશે. અસ્તુ.

સૌ ગુરુભાઈબહેનોને ગુરુપૂર્ણિમા નિમિતે

જ્ય ઓમ ગુરુદેવ - જ્ય નારાયાનુ.

વાચક મિત્રો,

અમને એ જીવાતા આનંદ થાય છે કે “દુતમભરા” સામયિકના આ અને હવે પછીના અંકો અમે ઓફસેટમાં પ્રિન્ટ કરાવવાનું વિચાર્યું છે. આ રીતે વાચકોને સામયિકના દેખો વાંચવામાં ઘણી સરળતા રહેશે.

- પ્રકાશન સમિનિ

કર્મના નિયમોને જે સમજતા નથી અને સમજયા પછી તેને જીવનમાં ઉતારતા નથી તે ખરેખર કરમ-જમગળા છે - મંદભાગી છે.

ગુરુ-સંતો પાસેથી તો ખૂબ સાંભળીએ ધીએ કે સંતકમોંથી સુખની અને અસંતકમોંથી દુઃખની પ્રાપ્તિ થાય છે. તેઓ તો પોકારી-પોકલીને આ વાતની આપણને અવારનવાર થાદ આપણા રહે છે; છતાંય આવી વાતો સાંભળનાગાંધો સંદ્ઘાય દુઃખી રહ્યા કરે છે. કશણે કે તેઓની મનાસ્થિનિ વિકૃત છે. અમુક શ્રોતાઓ તો આવી વાનોને નિયમિત સાંભળે છે ખરા પણ તેને સાચી જ માનતા હોતા નથી. તેઓ વિચારતા હોય છે કે -

(૧) કદેનારાઓ તો કહે એટલે કંઈ બધું સાચું માની વેવાય ? આવી બધી વાતો તો ઉપજાવી કઢેલી છે; આ બધાં તો પેટ ભરવાનાં પાંખડ છે - પ્રપંચ છે. જે સંતકમોંથી સુખી થવાનું હોય તો ઉપદેશ આપનારા કેમ સંતકમો કરીને સુખી નથી થઈ જતા ? તેઓ કેમ દુઃખી થતા જોવામાં આવે છે ? વરેરે વરેરે.

**જવાબ :** પ્રેક્ટર બીમાર હોય તો શું આપણે તેમની પાસેથી દ્વારા નથી લેતા ? અને તેથી સાજા નથી થતા ? તન-મન-ધન કે બીજી કોઈ પરિસ્થિતિની કમજોરીના કશણે પ્રેક્ટર પોતાના રોગન મટાડી થકતા હોય તેથી શું તેઓ બીજાના પણ રોગ ન મટાડી શકે (?) કે જેમને ઉપરોક્ત એકે પ્રકારની કમજોરી નથી

પૂર્મપાન કરવાથી નુકસાન થાય છે તે ચાલ પ્રેક્ટર જાળતા હોય પરંતુ પોતે ને જોડી થકતા ના

હોય તેથી શું પોતાના દરદીને પણ પૂર્મપાન છોડવાનું ના કહે ? દરદી પ્રેક્ટર કરતાં મજબૂત મનનો હોવાથી તેમના કથા પ્રમાણે વત્તિને જરૂર પાલ મેળવી શકે છે.

(૨) અમુક શ્રોતાવર્ગ એવો હોય છે કે જે આવી વાનો તો સતત સાંભળ્યા કરે છે પણ એમ જ માનતો હોય છે કે આ બધી વાનો તો બીજાઓ માટે છે. આપણા માટે નહીં. આપણું જીવન તો ભરાખર છે; બીજાઓએ આનું પાલન કરવાની જરૂરિયાત છે. આપણે નહીં

(૩) અમુક શ્રોતાવર્ગ એવો હોય છે કે જેને સંતકમોંથી સુખી થવાની વાતો તો સાચી લાગે છે અને નિર્ણય પણ કરે છે કે આવતીકાલથી જરૂર પાલન કરીયું પણ નેમની આપત્તીકાલ કરી આપત્તી જ નથી અને દુઃખો આવી પડે છે. તેથી તેઓ દુઃખી રહ્યા કરે છે.

(૪) અમુક શ્રોતાવર્ગ એવો હોય છે કે જેને સંતકમોની વાનો સાચી લાગવા છતાંય મનની અનિ કમજોરીના કશણે તેનું પાલન કરી શકતો નથી લાગવા ભોગવેલા અનિ અથ્ય સુખના બદલામાં થોડી સમય પછી ધરું મોટું દુઃખ ભોગવાનું પડયે એમ જાળતા હોવા છતાંય લાગવા સુખના પ્રલોભનને છોડી થકતા નથી ! જ્યારે દુઃખમાં નરહડતા હોય ત્યારે નકદી કરે કે હવે કદી દુઃખ પડે એવાં કર્મ કરવાનું નથી પણ દુઃખ પૂરું થતાંની સાથે જ પાછા જેસે હે, ૬૬ મટયું ને વૈદ વરી.

એક અનિ અથ્ય સુખને સામે જાલેલું જુઓ એટલે તેને ભોગવા એટલા નવપાપડ થઈ જાય કે તેની

પ્રતિક્રિયારૂપે આવતી કલે ધર્મ મોટું દુઃખ આવી પડવાનું હોય એ પણ તેમને દેખાય નહીં; સુખ ભોગવાની લાલચમાં નેચો એટલા બધા વિવેકાંધ થઈ જાય. અને કદાચ દેખાય તો પણ આ રીતે મન મનાવી વે કે કલે બલે કે ધર્મનું હોય તે થાય, આજે તો જલસા કરી લ્યો, કલ કોણે દીઢી? પરંતુ ચોવીસ કલાક પછી જ ફૂલશરી મારની કલ તો સામે આવીને જાબી રહે અને દુઃખનાં ગાંસડા-પોટલાં ખોલવા માંડે છે. આ લોકો આ રીતે સતત દુઃખી રહે છે.

(૪) અમુક શ્રોતાર્વાં એવો હોય છે કે કેમની મનાસ્થિનિ અસ્થિર હોય છે. નેઓને સંક્રમોદી સુખી થવાની વાનો થોડે સમય સાચી લાગે છે અને થોડે સમય ખોટી રેશી થોડે સમય નિયમોનું પાલન કરીને સુખી થાય છે અને થોડે સમય સ્વચ્છંદી બનીને દુઃખી થાય છે.

### પારખ ગુરુ નળો નો પુરા . . . . .

સંકલન - નૈયક આચ

જેઓ ગુરુની શોષમાં છે તેઓ વિચારના હોય છે કે ગુરુને ક્યાં શોષવા? ગુરુ તો કરવા છે પણ ગુરુ કોને કરવા? ગુરુ કેવા હોવા જોઈએ તે બાબતમાં કે વાંચ્યું છે અને સાંભળ્યું છે તેવી અને નેટલી યોગ્યતાવાળી જોઈ વિજિત જાણી જ ના હોય તો શું કરવું? આવા આવા મૂંજવણભર્યા અનેક પ્રભો આપણને થાય ને સહજ-સ્વાભાવિક છે. પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે આપણે નક્કી કરેલ છે તેનેટલી બાંધી જ યોગ્યતાવાળી વિજિત મળી જરો તો આપણે તેમને ઓળખી શકીયું? શું આપણું એટલી યોગ્યતા છે? કોઈના પણ ગાડ પરિયપ સિવાય મળનાંની સાથે તુલન જ તેમના વિપે આપણે શું જાણી શકીએ? વળી બુદ્ધિશાળી વિજિત જો ધારે તો પોતાના વિપે આપણને કંઈ જ ખબર પડવા ના દે અથવા પોતે કેવા હોય તે કરણાં પોતાને વહુ ખરાબ કે વહુ સારા પણ જનાવી શકે!

તેના માટે સહેલામાં સહેલો ઉપાય નો એ જ છે કે થોડી યોગ્યતાવાળી વિજિત મળે તો પણ આપણે

ઉત્તમમય

તેમનામાં ગુરુભાવના રાખી શકીએ, તેમને ગુરુ માની શકીએ, તેઓ પોતાની યોગ્યતા પ્રમાણે આપણું આગળ વધારી શકે. ને દરમ્યાન જો વહુ યોગ્યતાવાળા જોઈ મળી જાય તો તેમનામાં પણ ગુરુભાવના રાખીને વહુ આગળ વધી શકાય. “પીવું તો ગંગાજળ પાણી, નહીં તો રહું નર્સી” - આવો જડનાસુક્લ ઉદ્ઘાગ મુમુક્ષુએ કલ્યાણમાર્ગમાં કદી ના કરાય.

નેણે તો ગુરુજાણી થઈને જ્યાંથી પણ કલ્યાણકારી સામગ્રી મળે જ્યાંથી પ્રપન્નપૂર્વક લઈ જ વેવી જોઈએ.

એવા સદગુરુ-પૂર્વિગુરુ બહુ ઓછા હોય છે અને બહુ થોડાને પ્રામ વાય છે કે જેઓ એકદે એકથી પ્રારંભ કરાવીને ઠેઠ એમ.એ. સુધી લઈ જઈ શકે; અર્થાતું જેઓ પ્રથમ પગથિયેથી પ્રારંભ કરાતીને ઠેઠ ટોય સુધી લઈ જઈ શકે; અર્થાતું જેઓ સ્થૂળ-સૂક્ષ્મ અને ભૌતિક-આધ્યાત્મિક જથી જ શંકાઓનું સમાપ્તાન કરાવીને મુજિનુંપી સમાપ્તાનમાં સ્નાન કરાવી શકે. તેવા સમર્થ સદગુરુ મળી જાય તો પણ આપણે આપણાં અજ્ઞાન, અહંકાર અને અવળાંડાઈના કરાલે તેમને

ઓઈ બેસીએ છીએ; દીરે લાથથી નીકળી જયા પછી  
રોઈ બેસીએ છીએ. પરિપૂર્ણ ગુરુ મળી જાય તે તો  
મહાભાગ્યની નિશાની છે. તો તો ઓમપરમાત્માની  
અહેતુકી ટૃપા જ સમજતી.

આવા સદગુરુને ઓળખાનવા પણ કઠિન છે. કારણ  
કે તેમનું જીવન ઉપલક દુષ્ટિએ જોતાં બધી રીતે અનિ  
સરળ, સાધારણ અને અનિ સામાન્ય લાગે છે. અને તેથી  
જ તેમને ઓળખવામાં આપણે છેનશરીરે છીએ કારણ  
કે આપણામાં ઘણા ભ્રમો ધર કરી બેદા છે. કેમ કે -

સમર્થ સદગુરુ નો ચખસી શાલવાળા જ હોય, કે  
તેઓ તો છજ-પલગમાં જ પોઢના હોય, કે તેઓ તો  
મોટા મધ્યારી કે આશ્રમધ્યારી જ હોય, કે તેઓ તો  
કાપાયાંબરી કે ખેનાંબરી કે હિગંબરી કે કોપિનધ્યારી જ  
હોય; કે તેઓ તો અમૃક પર્મ-સંપ્રદાયના જ હોય; કે  
તેઓ તો ચમન્કારી જ હોય; કે તેમને શીગંડુ-પંછંડુ  
હોય અને આમ હોય અને તેમ હોય વગેરે. આવા  
બધા પૂર્વગાંધોથી મુજન રહેવું સરળ નથી. અને કો  
મુજન રહી થકાય તો સમર્થ સદગુરુ મેળવવામાં ઘણી  
સરળના રહી જાય.

સામાન્ય મનુષ્યોની, સાચા ગુરુસંતો વિમેની  
કસોટી પણ કેટલી વિચિત્ર અને વિસમયકારક હોય  
છે ! દર્શન માટે કલાકો સુધી લાઈનમાં જાઓ રહેવું  
પડે અને પ્રાણોના ઉત્તરો માટે ખારી મોટી રકમ  
આપવી પડે તો જ કેને સંતોષ યતો હોય તેના માટે  
શું કરવું ? અવળાંગી કહેશે કે -

“તો ગંગાજી ધરાઓંગણે આવે તો હું રેજ તેમાં  
સ્નાન કરું પણ ગંગાજી તો ધારે દૂર હોય છે, ત્યા સુધી  
પહોંચવું કઈ રીતે ?”

અને જો ગંગાજી ધરે સ્નાન કરાવવા આવે તો કહેશે  
કે -

“ધરે આવે તો ગંગાજી જ ના કહેવાય, ગંગાજી તો  
હરદૂર કે ઝાપિદેખમાં જ હોય.”

સ્વભાવની આવી અવળાંગી કારણે સાચા  
ગુરુસંતોને ઓળખાની શકાના નથી અને તેથી કાંઈ લાલ  
લઈ શકાનો નથી સૂર્યનારામણ કદી કહેવાના નથી કે  
હું સૂર્ય છું. તેઓ તો પોતાના અવિરત પ્રથમાં એવા  
લાગેવા રહે છે કે તેમને એવું કાંઈ કહેવાની જરૂરનેપ  
નથી કે સમયે નથી સૂર્યને સૂર્ય તરીકે ઓળખાની શકીએ  
નેટલી સમજાનું તો આપણે પોતે કેળવવી જોઈએ.

(ગુરુધરણ-સ્પર્શ-રહસ્ય પાન નં. ૧૬નું ચાલુ)

“બંને હસથી સ્પર્શ કર્યો હોત તો શું થાત ? કાંઈ  
જ નહીં. તો, પ્રવાહ એક લાથથી નમારામાં પ્રવેશન  
અને બીજા લાથ દ્વારા પાછો બાપુમાં પ્રવેશી જાન.  
નમારામાં અને બાપુમાં એ પ્રવાહ વર્તુળાકારે પ્રવાહિન  
થાત. તે વખતે અણાણણાટીનો અનુભવ જ ન થાત.  
અખૂરે ઘડે છલકાય, પૂર્ણ બરેલા ઘડામાં આધાપાછા  
થવાની કરાંય જગ્યા જ રહેતી નથી. આ રહસ્ય પણ  
સમજવા નેનું છે.

“વિદ્યુન વર્તુળાકારે ફરવા લાગે છે ન્યારે જ  
ગોળાનો(બલનો) નારે પ્રકાશિત થઈને પ્રકાશ ફેકવા  
માંડે છે. જો પ્રવાહ અંડાં ન રહે તો જબકરા થયા  
કરે. સમર્થ ગુરુજનો આપણા મસ્તકે સ્પર્શ છે ન્યારે  
તેમનો વિદ્યુનપ્રવાહ આપણામાં પ્રવેશે છે. તે વખતે  
આપણે તેમનો ચરણસ્પર્શ કરીએ છીએ. તે વખતે એ  
પ્રવાહ પાછો તેમનામાં પહોંચે છે. આ રીતે એક વર્તુળ  
પૂરું થાય છે. આપણામાં અને ગુરુદેવમાં તે પ્રવાહ  
વર્તુળાકારે જાપારે ફરવા લાગે છે ન્યારે અણાણણાટી કે  
જબકરા કેવી મોઈ અનુભૂતિ નથી થતી. પણ તેથી  
તો સાચા જીનાના ઉદ્યરૂપી ક્રાયમી સ્થિર અનુભૂતિ  
થાય છે. તે જ ખરી પ્રાપ્તિ છે. અરિથર અને ગૌણ  
અનુભૂતિઓથી ઉત્સાહ જરૂર વર્ષી છે પરંતુ  
નાં જ અટકી જવાનું નથી.

ગુરુદેવના મુખેથી આવું ગુણ રહસ્ય સાંભળીને  
સાંભળનારાં જાણે સમાધિસ્થ થઈ ગયાં.

## ગુરુ-સદગુરુ કોણ ?

સંકળન - નેત્રક ભાસ

જો કોઈની પાસેથી કંઈ પણ લઈએ તો કેની પાસેથી લીધું એ 'ગુરુ' કહેવાય; જેણે લીધું એ 'લધુ' કહેવાય. કેની પાસેથી આપણને કંઈ પણ શીખવા મળે એ આપણા ગુરુ. આપણી સંસ્કૃતિમાં આ સિદ્ધાંત મુજબ ધણા ગુરુઓને માન્ય કરવામાં આવ્યા છે. જેમ કે કર્મકાંડ કરવનાર પુરોહિત, આપણે તાં આવતા ગોર ઈત્યાદિ. આમ લૌકિક વિદ્યા માટે ગુરુ શબ્દનો ઉપયોગ થાય છે. શાસ્ત્રમાં ગુરુ-સદગુરુ શબ્દ બધા માટે નથી વપરાયો. સદગુરુ તો એક જ કે જેણો આત્મા અને પરમાત્માની ઓળખ કરાવે. તમામ ભૌતિક વિદ્યા-કળા કરનાં જે વધુમાં વધુ ગુરું છે, મૂલ્યવાન છે, કેનાથી મૂલ્યવાન બીજી કોઈ હોઈ જ ના શકે નેવી જે આધ્યાત્મિક વિદ્યા, તેનું જીવાન જે આપે તે ગુરુ, લૌકિક લધુવિદ્યા કરનાં અલૌકિક ગુરુવિદ્યા આપી નેથી તેમને ગુરુ કહ્યા. 'વિદ્યા આપી' એટલે ? તે જેવા સ્વરૂપમાં હતી નેને તેવા સ્વરૂપમાં સમજાવી લૌકિક વિદ્યા આપનારાઓ માટે સલાહકાર, માસ્ટર, ઉસ્નાદ, માર્ગદર્શક વગેરે શબ્દો વપરાયા. ગુરુ શબ્દ કોઈના માટે ના વપરાયો.

માત્ર પિના તથા આચારોને દેવો કષ્ટા છે. નવ માસ માનાના ગર્ભમાં રહ્યા અને તારબાદ પણ ધણા સમય સુધી માનાના આપારે રહ્યા માનાના ક્ષેત્રમાંથી છૂટા યઈને મોટા થતાં પિનાના ક્ષેત્રમાં આવ્યા તાં પિનાની સહાય અમુક સમય સુધી લીધી પિનાની સહાયતા દરમાન જ એમની સહાયતાને આપારે બીજા ધણાની સહાયતા લઈ શક્યા અને એ દરમાન સ્ફૂર્તમાંથી કોણેજ સુધી પહોંચી ગયા અને ડિઝી મેળવી

તુલભય

લીધી આમ પિનાની સહાયતા ઉપર નિર્ભર રહી બીજા ધણાની - જેમ કે માસ્ટર, પ્રોફેસર વગેરેની જીવનઘડુનરમાં સહાય લીધી.

માના-પિનાની સહાયતા દરમાન જ અમુક સમય પછી કપંગની જરૂર પડી, લોંગની જરૂર પડી તો એ સહાય દરજ, મોચી વગેરેથી પ્રામ થઈ. ભાષા વગર કોઈને થોડું ચાલ્યું છે ? ભાષાની જરૂર પડી પરદ પશ્યનિ, મથ્યમા તો હતી જ પરંતુ તે પછી વૈભરી શરૂ થઈ. આમ થોડા વર્ષો દરમાન જ ધણાબધાની ધણીબધી મદદ એક વિકિના વિકાસ પાછળ હોમાઈ ગઈ.

**મિત્ર :** તું કહે છે કે - 'હું એનિનિયર' પણ એનિનિયર જનાવવામાં કેટલાંની જરૂર પડી એનો વિચાર કર્યો છે ? તું એનિનિયર થયો એ વિદ્યા કોઈ ગુરુ પિના નને થોડી પ્રામ થઈ ?

**એનિનિયર :** એટલા માટે જો મારે ગુરુનો સ્વીકાર કરવાનો હોય તો હું એનિનિયરપણું પાછું આપી દઈ છું, એના પિના જીવીશ.

**મિત્ર :** આ અંગેજ તથા ગુજરાતી બોલી રચ્યા હો ને !!

**એનિનિયર :** એ પણ ના જોઈએ. ગુરુ પણ ના જોઈએ. ગુરુની શી જરૂર છે ?

**મિત્ર :** આમ બધું જ આપી દઈશ તો તારી પાસે શું રહેશે ? શરીર એ પણ નાંનું ક્યાં છે ? તે પણ માના-પિનાએ આણ્યું છે.

એન્જિ. : (સ્વગત) શરીર પણ છોડી દઉ તો માંથું  
અસ્તિત્વ જ ક્યાં રહ્યું ? અને શરીર રાખ્યું એટલે એક  
પછી એક બધાંની જરૂર પડે.

મિત્ર : સમજ્યો ? ગુરુનો સ્વીકાર કર. ગુરુને ના  
સ્વીકારો એટલે શુંય.

મનુષ્યશરીર પારણ કર્યું, ધારું બધું શીખ્યા શા માટે?  
આત્મા-પરમાત્માના જ્ઞાનમાં સહાયરૂપ હતું એટલે આ  
બધું શીખ્યા જેની સહાયની જેમ જેમ જરૂર ઓછી  
તેમ તેમ તેનું ગુરુપણું ઓછું. જેમ કે મોચીથી આગળ  
દરજા, દરજાથી આગળ માસ્ટર, માસ્ટરથી આગળ  
પ્રોફેસર, પ્રોફેસરથી આગળ ડોક્ટર વગેરે. બીજું બધું  
ધોવા છન્હાં જો શરીર અસ્વસ્થ થઈ જાય તો પ્રથમ  
જરૂર પડે ડોક્ટરની બાધારના ગુરુ પછી, અંદરના  
શરીરને સંભાળનાર ડોક્ટરની અગત્ય વપારે. એની  
અનેક શાખા થઈ. પગ, લાય, પેટ, ફેફસાં, હદ્ય વગેરે.  
હદ્યમાં કંઈ થઈ જાય તો હદ્યરોગના નિષ્ણાનને  
નાબડતોબ બોલાવવા પડે. શરીરમાં હદ્યની કિમત-  
અગત્ય વધુમાં વધુ છે તેથી એના ડોક્ટરની કિમત-  
અગત્ય પણ વધુ. આખા શરીરમાં હદ્ય વધુ કિમતી  
છે કારણ કે હદ્યમાં પરમાત્માનો રાસ છે.  
શરીરમંહિરમાં બિરાજનાર હદ્યમાં જે ચેતન-પરમાત્મા  
બિરાજમાન છે - પંચમાલાભૂતના શરીરમાંથી એ  
ગુદુદેવ ચાલ્યા જાય તો શરીરમંહિર નકારું થઈ જાય.  
મૃત શરીરની અંખ જુઓ ત્યારે જ ખબર પડે કે  
જીવંત શરીરની શી વિયેપતા છે.

આપણા અસ્તિત્વ દ્વારા આપણા માનાપિતાનું  
અસ્તિત્વ સિદ્ધ થાય છે તેમ આપણા અસ્તિત્વથી જ  
આપણા ગુરુનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે.

જેને પોતાનાં માનાપિતા કોણ એની ખબર ન હોય  
તેને માટે સમાજમાં ધારું નીચું સ્થાન છે. એવી જ રીતે

જેને પોતાના ગુરુ કોણ એની ખબર ના હોય તેનું કેવું  
સ્થાન હોય ?

આત્મા અને પરમાત્માની વાત  
સમગ્રાયે, ગુરુઓના ગુરુ ઓમનારાયણનું  
જ્ઞાન આપે, આપણું પ્રકૃતિ, સ્વભાવ,  
સ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખી જ્ઞાન  
આપવાનો પ્રવન્ત કરે તે સદગુરુ. પરમાત્મા  
એટલે કે સર્વબાપક તત્ત્વ કેવળ મંહિરોમાં  
જ છે, કે પાનાળમાં જ છે, કે અમુક દિશા  
કે અમુક જગ્યામાં જ છે, એવી માન્યતાને  
ફેરવી, જે કાંઈ સ્થાવર કે જંગમ છે એ તમામ  
પ્રલુનું જ સ્યારુપ છે, પ્રલું જ સ્થાવર-જંગમ  
તરીકે વિલસી રહ્યા છે તે વાતની તથા  
શરીરની જનિશીલતા, પ્રવૃત્તિ, ચેતનપણું  
વગેરે જેના આપારે છે તે તત્ત્વની સમલાળ  
આપે તે સદગુરુ. ઉપરાંત ગુરુમાં જે માને છે  
એને તો ગુરુ છે જ, પરંતુ જે ગુરુમાં નથી  
માનતો તેને પણ ગુરુ છે એવું જે સાબિત  
કરી આપે તે સદગુરુ છે.

ઈટ-ચૂનાના મંહિરમાં મૂર્ખિયે ભગવાનને  
બેસાડનાર જો હદ્ય હોય તો તેનું જ્ઞાન હોવું જરૂરી છે.  
મૂર્ખ-ભગવાન એની મેળે મંહિરમાં બેસના નથી એ  
બધાં ઈટ-ચૂનાના મંહિરની દેખભાગ રાખનાર શરીર-  
મંહિર છે. તો ઈટ-ચૂનાના મંહિરમાં ભગવાનને  
બેસાડનાર ભગવાન, જે મંહિરમાં બેશ છે, એ મંહિરની  
કેટલી સંભાળ રાખવી જોઈએ (!) જેવી ભગવાન લાંબો  
સમય મંહિરમાં રહી શકે, ઘરે મહેમાન આપવાના હોય  
તો એ સમયે ઘરને કેટલું સ્વચ્છ રાખીએ છીએ ?  
મહેમાન આપણે લાં ક્યારે વધુ રહે ? જ્યારે એમને  
આપણે લાં રહેવાનું જરૂર ત્યારેને ? અસ્તુ,

સાચી ગુણપતિ પૂજા  
જીવનસાધના - પોગ સાધના

ગુણપતિ ગુણ આગળ રહો,  
શોઈ કર જોડે દાસ,  
સદ્ગ સર્વદા સમરતાં,  
વિઘ્ન ન આવે પાસ.

ગુણપતિ એટલે ગુણોના પતિ, જે સર્વગુણસંપન્ન છે, જેનામાં તમામ ગુણો છે, ગુણો ઉપર જે કાબૂ શાખવાવાજા છે - કાબૂ ધરવે છે એવા ગુણોના પતિ કોણ છે? પરમાત્મા, પાંત્રિક યોગદર્શનમાં જેમના માટે "તસ્ય વાચકः પ્રાણવः" અર્થાત ને (ઈશ્વર)નું નામ પ્રાણવ (ઓમ = ઽં) છે, સૂત દ્વારા તેમનું નામ ઓમ છે એમ કહેવામાં આવું; તે પરમાત્મા ગુણોના પતિ છે. શરીરસ્થ પદ્યદ્રષ્ટમાં મૂલાધારની જે કલ્પના કરવામાં આવી છે તાં ગુણપતિનો નિવાસ છે.

ગુણોના પતિ, ગુણપતિની સાચી પૂજા ક્યારે થઈ કહેવાય? જ્યારે મૂલાધાર યક્ણી શુદ્ધ થાય ન્યારે, મૂલાધારની શુદ્ધ એટલે આંતરડાની શુદ્ધ, આંતરડાની શુદ્ધ એટલે મળદ્વારની શુદ્ધ, મળદ્વારની અશુદ્ધ એટલે કલજિયાન, જે સર્વ રોગનું મૂળ છે એમ આધુનિક વિજ્ઞાને સ્વીકારેલું સત્ય છે. પરંતુ યોગશાસ્ત્રમાં તો એ વાત ધારા પુરો પહેલાં કહેવાઈ જઈ છે. એટલે યોગશાસ્ત્રની રીતે વિચારીએ કે આરોગ્યશાસ્ત્રની રીતે વિચારીએ; મૂલાધારની શુદ્ધ એ જીવનસાધના માટે તે યોગસાધના માટેનું અનિવાર્ય એવું અગ્નયનું આપથક અંગ છે.

પહેલામાં પહેલો ગુણ એ મૂલાધારની શુદ્ધ, બીજી ગમે નેટલી શુદ્ધઓ હથે પણ મૂલાધારની-મળદ્વારની

શુદ્ધ નહીં હેઠ તો શરીરમાં રોગ પેસી જથે રોગ પેસવાનું, મૂળ દ્વાર કલજિયાન જ છે. ધર્મી વાર એવા પ્રભો થાય છે કે અમારે ક્યાં યોગસાધના કરવી છે કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે તે આવી બધી વાનોમાં પડીએ? પણ પ્રામ મનુષ્યજન્મને સાર્થક કરવો હોય તે સૌને માટે જીવનસાધના આપથક છે જ.

જીવનનું નામ 'યોગ' જલે ના આપીએ પણ તે યોગ જ છે, નેથી જીવન પણ મહાન સાધના છે. અને નેથી જીવનસાધના માટે, સાચી ગુણપતિની પૂજા માટે પણ યોગની રીતે જ જીવનું પડ્યો અને તો જ જીવન સાધના બની શકે.

સર્વગુણસંપન્ન પરમાત્માનું નામ ઓમ છે. ઓમ કહેતાં જે નત્ય આપણી સમજ આવે છે, તે ગુણપતિ-ગુણપતિ, તેનું સદ્ગ સર્વદા ચોવીસ કલાક અને બારે મહિના સ્મરણ કરવામાં આવે તો પછી વિઘ્ન ન આવે પાસ, પાસે વિઘ્નો આવી શકે નહીં. વિઘ્નને આપવા માટે જગ્યા નો જોઈએ ને? એ જગ્યા આપવે આપીએ જ નહીં તો વિઘ્ન આવશે કેવી રીતે?

"તુલસી દોનો ના રહે, રવિ-રળનિ એક ક્રમ" સૂર્ય અને રાત્રિ બને એક સાથે રહી શકતા નથી. તેવી જ રીતે જ્યાં સદ્ગ સર્વદા સ્મરણ (ગુણપતિનું) છે આં વિઘ્ન આવી શકતું નથી, ફરકી શકતું નથી.

## ભલ સત્ય જગત મિથ્યા - પરમગુર

આવા જે ગુણોના પતિ, ગણપતિની ઓળખ દાસ સહજ સહગુરુની આરતીમાં કંઈક આવી રીતે આપી રહ્યા છે.

આદ અનાદ નાદથી પર છો, અજર અમર દેવ,  
જુદુ અજર અમર દેવા, નહીં ઊપજય, નહીં જાય,  
છો એવા ને એવા જુદુ છો એવા ને એવા.

હે ગુરુદેવ ! તમે કેવા છો ? આહિ અને અનાહિ એ બ્યાધી પર છો. નમારો આદિયે નથી અને નમારો અનાદિયે નથી જેનો પ્રારંભ હોય એનો અંત હોય. પરંતુ પરમગુરુ-પરમાત્મા કેવા છે ? જેમનો જન્મેય નથી અને મૃત્યુ નથી એવા. 'અજર અમર દેવા' - જે અજરું જરાવાળા નથી; અમર, મૃત્યુવાળા નથી વૃધ્ઘાવસ્થા અને મૃત્યુ એ તો શરીરના પર્મો છે. પરમગુરુને તો શરીર જ નથી, એ તો પરમ ચૈતન્ય છે. તેથી નમારું ઉત્પન્ન થતું, ઊપજવું છે જ નહીં. અને તેથી નમારો નથી તો જન્મ થતો કે નથી તો મૃત્યુ થતું. અને તેથી તમે કેવા છો ? છો એવા ને એવા! જ્યારથી જેવા છો ત્યારથી અત્યાર સુધી અને હવે પછી જાયમ માટે, એવા ને એવા જ રહેશો. નમારા સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી આવતું.

પરમ ચૈતન્ય, પરમાત્મા સિવાયના જગતના તમામ પદાર્થો કેવા છે ? પરિવર્તનશીલ છે. જેમ કે દૂધ, દૂધમાંથી દહી, દહીમાંથી દહીનો વિકાર દી; એમ દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. રોવાઈમાંથી શરીર, શરીરમાં અંગો અને એમાં ભીત્ર ઘણા ભણા વિકારો. શરીર પડી જાય તો નેમાંથી બસ્તમર્પી વિકાર.

અન્યારે જગતનું જે સ્વરૂપ દેખાય છે. તે થોડીક કાશો પછી એનું એ નહીં હોય એના સ્વરૂપમાં કોઈ ને કોઈ ફરક આવી જાય હશે. આપણાં ચર્મચક્કાઓ એ પદાર્થમાં આવેલ પરિવર્તનને જીવે આજે જોઈ શકતાં ન હોય પરંતુ આજે નહીં તો જ મહિના પછી, એક વર્ષ પછી જ્યારે એમાં ઘણો ભણો પલટો આવી જશે જ્યારે આપણી ઈન્દ્રિયો એનો અનુભવ કરી શકશે. કાણે કાણે અને પળે પળે દરેક વસ્તુમાં આવતું પરિવર્તન એટલે જ વસ્તુનું મિથ્યાપણું. અનિ સૂતમ પ્રમાણમાં થતાં પરિવર્તનનો ઈન્દ્રિયઅગોચર હોવાથી, ઈન્દ્રિયો દ્વારા તે અનુભવી શક્તા ના હોવાથી તેના મિથ્યાપણાને આપણે સમજ શક્તા નથી અને નેથી તેને આપણે શાશ્વત સમજ લઈયે છીએ.

પરમ ચૈતન્ય, ગુરુદેવ તો કેવા છે ? અપરિવર્તનશીલ, જેવા છે એવા ને એવા અને નેથી કહું ભલ સત્ય, જગત મિથ્યા. ભલ જ એક સત્ય, સત્ય કહેતાં જેમાં પરિવર્તન નથી સત્ય એટલે અસત્ય નહીં. એ જેવું છે એ સ્વરૂપમાં, અસત્ય પણ નહીં, પણ સત્પણું-સતતપણું, જેનું અસ્તિત્વ સતત, જેનું સતત સતત એવું સ્વરૂપ. નેથી ભલ સત્ય અને જગત પરિવર્તનશીલ હોવાથી મિથ્યા.

'અમર રૂપ બન્યા છો આપે વિદેહ દેહપારી' પરમ ચૈતન્ય, પરમાત્મા કેવા છે ? અમર રૂપે આપ અમર છો. વળી વિદેહ. વિના દેહ અર્થાતું આપ વિશિષ્ટ દેહવાળા છો, દિવ્ય દેહવાળા છો. હાડ-ચામ જેવો દેહ(શરીર) છે એવો નમારો દેહ (શરીર) ન હોવાથી તમે વિદેહી, દેહ વિનાના છો, જે બુદ્ધિગમ્ય, જ્ઞાનગમ્ય છે.

## ગુરુદીક્ષાં પ્રયત્ન મે

અનેક પ્રકારની ગીતાઓમાં ગુરુગીતા શ્રેષ્ઠ છે. ગુરુગીતાના પ્રારંભમાં જ માતાજી પાર્વતીજી દેવાનિદેવ મહાદેવ કે જે એમના પણ છે એમની પાસે ગુરુદીક્ષાની માગણી કરે છે. તમે મને દીક્ષા આપો, મારુ ગુરુ બનો. આજે માતા પાર્વતીજી ગુરુનું પરલું કરી રહ્યો છે - ત્થિતાસુ થઈને મહાદેવની પાસે આવ્યો છે.

મહાદેવજી જ્યાં સુધી પણ હતા જ્યાં સુધી પાર્વતીજીને પણનું સુખ મળતું હતું, પણ તરીકેની ફરજો મહાદેવજી બજ્જાપના હતા. પરંતુ એક ગુરુ પાસેવી શિષ્યને જે મળો અથવા શિષ્યને જે મળો ને એમને મળતું ન હતું, પણી હોવા છનાં. એ ક્ષારે મળો ? શિષ્યા બને ત્યારે, આ વાનમાં એક ડાંતું રહસ્ય છે. આ રહસ્ય બીજે ક્ષાંય સાંભળવા ના મળો. તમે સૌ ઓમપરિવારમાં છો એટબે તમને આ સાંભળવા મળ્યું છે, એમાં શું રહસ્ય છે ?

જેઓ સમર્થ ગુરુજો છે તેઓ સગપતુની રીતે આપણા ગમે તે થતા હોય - ચાહે કાકા, મામા, ભાઈ, પિના કે પુત્ર થતા હોય પણ જ્યાં સુધી એમની સાથે સગપતુનો સંબંધ રાખીએ ત્યાં સુધી, એ સગપતુના સંબંધી એમની જે જવાબદારી હોય એ અદા કરે, જેમકે - ભહેન સાથે ભાઈ તરીકેની, ભાણેજ સાથે મામા તરીકેની, ભરીજ સાથે કાકા તરીકેની, પણી સાથે પણ તરીકેની જવાબદારી સંભાળે. પરંતુ શિષ્ય કે શિષ્યને ગુરુ નરફિથી જે મળો ને એમને ના મળો, એ ક્ષારે મળો ? શિષ્ય કે શિષ્યા બને ત્યારે,

પરંતુ સગપતુ વિનાની જે અહારની દુનિયા છે, જે તેમની સાથે શિષ્યભાવે પર્તન કરતી હોય તો તે સૌ સાથે એ ગુરુ તરીકેની જવાબદારી અદા કરે. ગુરુ તરીકે

જે કાંઈ મળતું હોય એ તેમને એટબે કે શિષ્ય અને શિષ્યાઓને તે જે એમનામાં ગુરુભાવ રાખતાં હોય એમને ગુરુ નરફિથી મળો.

માતા પાર્વતીજીએ જ્યારે ગુરુદીક્ષાની માગણી કરી ત્યારે મહાદેવજીએ એમને કહ્યું કે 'ગુરુ વિના બીજું કોઈ ભ્રબ નથી' આજ સુધી મહાદેવજી કહેતા નહેતા કશણુકે આજ સુધી પાર્વતીજી પણી તરીકે વર્તતાં હતાં. પરંતુ આજે પાર્વતીજી પણી હોવા છનાં જિજ્ઞાસુ થઈને આવ્યાં ત્યારે મહાદેવજી સાચી વાત કરી રહ્યો છે. આજ સુધી ખોટી વાત કરતા-કહેતા હતા એમ નહીં. પરંતુ આજ સુધી એમની જવાબદારી પણ તરીકેની હતી તેથી પોતાનાં પણીને પણ તરીકે જે કાંઈ કહેવાનું હતું એ કહેતા હતા. આજે શિષ્યભાવે આવ્યાં છે એમનાં પલી; તો શિષ્યા માટે જે કહેવાનું છે ને કહી રહ્યા છે :

જપસાપો પ્રતં નીર્યે પજો દાન નરૈવ ચ  
ગુરુતત્ત્વમ વિજ્ઞાય સર્વ વર્વ ભવેન્નિષ્પે

દે પ્રિયે ! ચાહે ગમે એટલાં પજો, પ્રતો, તપો, દાન, જપ, નીર્ય કરો; ગમે ને કરો; પણ જ્યાં સુધી ગુરુતત્ત્વને સાચી રીતે - નાલ્યિક રીતે ન જાણો ત્યાં સુધી કંઈ ફળતું નથી અને મૂડની જેમ જ જીવન પૂરું થઈ જાય છે.

## ગુરુપ્રામિ આહમુક્તિ

શ્રી આહિ શંકરાચાર્ય મહાનને ગુરુઅષ્ટકના એક શ્વોકમાં શ્રીગુરુના ચરણકુમરોની મહત્વાળાની કથું છે-

ન બોગે ન વા યોગે ન રાજભોગે  
ન કંતાસુખે નેવ વિતેસુચિતં  
ગુરેરહધીપદે પનસેન લગ્નમ  
તન: કિ તન: કિ તન: કિ તન: કિ

વિપયના ઉપભોગમાં, વિપયપદાર્થની પ્રાસિદ્ધ  
યોગમાં, રાજ્યના ઉપભોગમાં, સ્ત્રીસુખમાં અને  
સંપત્તિ આહિ કોઈ પદાર્થમાં મન લાગેલું ન હોય; છનાં  
નો શ્રી ગુરુના ચરણકુમરોમાં મન ન લાગ્યું હોય તો,  
એથી શું ? એથી શું ? એથી શું ? એથી શું ?

મનુષ્યે આવો અપ્રાપ સંઘમ પ્રામ કિંદો હોય છનાં  
ગુરુશરણે જરું અનિવાર્ય છે. કશણે કે જો તે તેમ ન  
કરે તો એક સમય એવો આવે કે પોતાના સંપત્તી  
જીવનથી પણ નેને અહંકાર આવી જાય અને તો તે  
તેના સર્વનાયનું કશણ બને છે.

જગતના તમામ મનુષ્યો અહમના બોજથી પીડતા  
હોય છે, અહમ આપણા ઉપર એટલી હદ સુધી સવાર  
શરીર ગયો છે કે દિવસે તો દીક, રાતે ઊંઘમાં પણ  
એનાથી મુક્ત થઈ શકાનું નથી અહમ યુક્ત મનુષ્યની  
પરિસ્થિતિ ટ્રેનમાં મુસાફરી કરતા પેલા મુસાફર જેવી  
છે જેણે ટ્રેનમાં હોવા છનાં પોતાનો સામાન પોતાના  
માથા પર મૂડી રહ્યો છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધ્રાંજું અનુકરણ કરી રહેલા  
બુદ્ધિજીવીના મનમાં પ્રશ્ન એ થાય છે કે ગુરુસંતોની  
જરૂર શી છે ? તેમના સંપર્કમાં રહેવાથી આપણને શું  
પ્રામ થાય છે ? મનુષ્યે અહમના બોજમાંથી મુક્ત

થવા માટે ગુરુજનોના સંપર્કમાં રહેવાનું છે. ગુરુજનોના  
સંપર્કમાં આવી જો કોઈ પ્રામ કરવાનું હોય તો તે છે  
‘અહમુક્તિ’.

અહમ નો બોજ એટલે ‘હું કંઈક કરી રહ્યો છું’.  
‘અહમ કહેનાં હું’, એનો ભાર જીવનમાં એટલો બધો  
હોય છે કે જરા, મૂલ્ય અને રોગ અકાળે આવી જાય  
છે. એમાંથી મુક્ત થવું જોઈએ; અને એમાંથી મુક્ત  
થવા કોઈ શ્રદ્ધેય વજિનને આપણે આપણા ગુરુપદે  
સ્થાપી દેવી જોઈએ કે જેણી પાસે આપણે આપણા  
અહમ મૂડી શકીએ; આપણા લાભ માટે, આપણા  
કલ્યાણ માટે.

અહમને છોડી દઈએ ત્યારે જ સાચો  
આરામ પ્રામ થાય. એવો આરામ પ્રામ જ ન થાય  
તો આ શરીર ક્યા સુધી ચાલી શકે ? સારામાં સાંદુ  
ખાઓ-પીઓ, દવા-ઈન્જેક્શન વગેરે બધું લો, છનાં  
માણસ સાંજે થાકી જાય છે. અને એ બધો થાક ક્યારે  
જાને છે ? રાતે જયારે એને મીઠી ઊંઘ આવે ત્યારે.  
મીઠી ઊંઘ ક્યારે આવી કહેવાય ? જાને સાંભળવાનું,  
નાકે સુંધરવાનું, આંખે જોવાનું છોડી દીખું હોય; બાંધ  
ઈન્ડ્રિયોથી જાપારે મુક્ત થઈ ગયા હોઈએ ત્યારે સંપૂર્ણ  
આરામ મળે છે. અને રાતે એવી ઊંઘ આવે ત્યારે  
સવારે સ્ફૂર્તિનો અનુભવ થાય છે. પરંતુ આ બધું કરવા  
છનાં કેને પરિપૂર્ણ આરામ કહેવામાં આવે છે તે ન નથી  
મળતો. પાંચ ઈન્ડ્રિયો દ્વારા થનાં કર્મો છોડી દીક્ષાં હોય  
ત્યારે પણ અહમ તો હોય જ છે. નો એ અહમ આપણે  
આપણી જાતને જાપારે કોઈ શ્રદ્ધેય વજિનને સર્મિંપિત  
કરી દઈએ છીએ ત્યારે છૂટે છે.

આપણે આપણા લાભ માટે, આપણા અહમના  
બોજમાંથી મુક્ત થવા માટે, જે પોગ્ય લાગે એને ગુરુ

નરકિ સ્વીકારીએ. અને એ સ્વીકાર એટલા માટે કરવાનો છે જેથી આપણે આપણો 'આહમ' એમના ચરણોમાં મૂડી શકીએ-દઈએ. ગુરુને તો અજર પણ નથી હોતી કે એમને કોણ સમર્પિત થઈ રહ્યું છે, એમનો ચેલો કોણ છે; ગુરુદેવ તો એમની મસ્તીમાં મસ્ત હોય છે.

આહમસુખ થઈએ એટલે ગુરુપ્રાર્થ સહજમાં અસ્તુ.

### સાહેબ કૃપા સહજ ધર પાયો.....

દાસ સરજી કહે છે કે- સાહેબ કૃપા સહજ ધર પાયો, પલ પલ બલિદારી.

'સાહેબની કૃપા થઈ, આહી પરમાત્મા તથા સદગુર એમ બંને માટે સાહેબ શરીર વપરાપો છે. ગુરુદેવની કૃપા થઈ નારે શું થયું? 'સહજ ધર પાયો.'

એ પરમાત્માના સ્વરૂપને ઓળાખવા માટે, પામવા માટે, સારી રીતે છુદ્યંગમ કરવા માટે યોગીજનો, મહાત્માઓ, સાધુજનો કેટલી મોટી નપશ્યા કરે છે! કેવાં ગાડ મહાંગલોમાં કુટિયા જનાવીને રહે છે, ગુણમાં રહે છે! આટલું કરવા છતાં જે સમજમાં નથી આવી શકતા એવા પરમાત્મા, સાહેબની-સદગુરુની કૃપા થવાથી અમારી સમજમાં સહજ રીતે આવ્યા.

અને માટે અમારે કોઈ કષ ઉકાવવું પડ્યું નહીં, ધરે બંધુ બેઠાં જ અમારાં ચાલુ વ્યવહારનાં કામકાળો કરનાં કરનાં, અમારાં પોતાનાં ભાગભાગ્યાઓનું પાલનપોતાનું કરનાં કરનાં જ સહજમાં ધેર બેઠાં જ મેળવ્યા. અને શરીરમાં પરમાત્માનું જે ધર છે એ ધરમાં તેમને જોયા-સહજનદળ કમળમાં સદગુરુની કૃપાથી, આ જરૂર 'સહજમાં શક્ય બન્યું, તેથી સદગુરુદેવને હું પલ પલ બલિદારી' થઈ જયો; હું ન્યોચાપર થઈ જયો. સદગુરુદેવ સમજ મારી જાતને અર્પણ કરી દીનો, મારી જાતનું બલિદાન આપી દીનું, જીવનની હર પલનું બલિદાન આપી દીનું, અસ્તુ.

## આરતી કોની ઉતારાય

ધોગાંભિકૃ

પરમાત્માની આરતી ઉતારવાની પરિપાટી આપણી સંસ્કૃતિમાં છે. અને પરમાત્મા-સ્વરૂપ ગુરુદેવની પણ આરતી ઉતારીએ છીએ. એક થાળીમાં તાણ કે પાંચ શુદ્ધ ગૌધૂનયુક્ત દિવેટો પ્રગટાવીને આરતી ઉતારાય છે. ગુરુસંતોને આપણી સન્મુખ રાખીને નેમની સામે જાબા રહીને આપણા બંને લાથથી, પ્રગટાવેલી દિવેટોથાળી થાળીથી આરતી ઉતારીએ છીએ. આરતી ઉતારતી વખતે થાળીને ગુરુસંતોના ચરણ પાસેથી (આપણી) હણી બાજુથી મસ્ઝક બાજુ ઉપર વઈ જઈ અને જમણી બાજુથી નીચે ઉતારતા ઉતારના પાછા પણ નરફ વઈ જવાની આવા વર્તુળાકારની પુનરાવૃત્તિઓ કરીને આરતી ઉતારાય છે. અમુક સમય સુધીનો એ ક્રમ પૂર્ણ કરી એ થાળીને ઉપસ્થિત સર્વે ભાઈભાઇનો આગળ પડીએ છીએ. ત્યારે ને સૌ આરતીની જ્યોત ઉપર થોડ છેટે પોતાના બંને લાથના પંજાઓ ફેરવે છે. અને પછી પોતાનાં અંગળાઓ પોતાની આંખે, કપાળે અને માથે અડકાઉ છે.

આ કિયા કેટલી ગુલ્ફ, જડન અને રહસ્યયુક્ત છે!? આ કાંઈ સામાન્ય વાત નથી. એક તો આ આરતી એટલા માટે ઉતારવામાં આવે છે કે, સામાન્ય મનુષ કે જેની સિથિનિ ગુરુજનોના પગમાં બેટ મૂકવા જેવી નાં હોય એ પણ નેમને પોતાના ઘરે બોલવાની, આરતી ઉતારી અને પોતે પણ ગુરુસંતોની પખરામણી કરી શક્યાનો સંતોષ વઈ શકે, ગુરુસંતોને બેટ મૂકવા પણ ન હોય તો તન-મનથી પણ આરતી ઉતારી શકાય. આરતી ઉતારવી એટલે ગુરુસંતોના શરારે થઈ જતું

એવો ભાવ છે, તો આમ, આ રીતે એક અંકિયન પણ આરતી ઉતારીને સંતોષ વઈ શકે છે.

બીજી વાત, આરતી વૈનું પ્રતીક છે ? એમાં તાણ કે પાંચ વાટો જ કેમ ? નથી વાટો-દિવેટો નિગુણનું પ્રતીક છે. અને પાંચ દિવેટો પંચમદાલૂતનું પ્રતીક છે. રજસ, નમસ, અને સત્યરૂપી તાણ ગુણો અને પૃથ્વી, જળ, અદ્દિન, વાયુ અને આકાશરૂપી પાંચ ભૂતોથી ઉપર નીકળી જવાનું છે. પ્રકાશરૂપી જ્ઞાન પ્રામ કરીને નિગુણ અને પંચમદાલૂતોથી પર થઈ જવાનું છે.

ધરણાં વર્ષોના અને ધરણા મોટા અવકાશમાં વ્યાપેલા અંધારાને પણ દૂર કરવા એક જ્યોત બસ થઈ રહે છે; ચાહે એક દિવસનું કે અનેક જન્મોતું અંધારું હોય તે, જ્યોત સમજી, પ્રકાશ સમજી જાબું નથી રહી શકતું. અંધારું પછી એમ નથી કહેતું કે હું ધરણા વિસ્તારમાં અને ધરણાં વર્ષોથી હું તો મને દૂર કરવા ધરણી જ્યોતો ધરણા સમય સુધી પ્રગટાવો. એ તો જ્યોત પ્રગટ થતાંની સાચે નાસી જ જાય, રહી જ ના શકે.

જ્યારે સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે નિગુણની અને પંચમદાલૂતની માયા છૂટી જાય છે. ચાહે આપણા શરીરરૂપી પંચમદાલૂત હોય કે ચાહે ઇપાળી પણીના શરીરરૂપી પંચમદાલૂત હોય, કે ચાહે જગતના કોઈપણ પંચમદાલૂતનું અનિ સ્વરૂપવાન નામ-રૂપાત્મક શરીર હોય, તે તમામમાંથી માયા અને મોહ ટળી જાય છે.

ગુરુસંતોના કૃપાપાત્ર બનનાર જ્ઞાનીને દરેકમાં પંચમદાલૂત જ દેખાય છે. અચિપન, જુવાની, ભુગ્યાપો,

૩૫, કુરૂપ, રેગ નિરોગ તે તમામની પેબે પાર તેસે તે સર્વમાં પંચમાલાલૂન અને નિગૃહ જ દેખાય છે.

આરતીનો પ્રકાશ જાણનું પ્રતીક છે. આરતીનું એક બીજું પણ ધર્મ મોટું રહસ્ય છે. આરતી પછી આપણે તે જ્યોત ઉપર કરતલ ધરીને-ઇરવીને પછી એ કરતલથી આપે, કપાળ અને માદે સ્પર્ધાએ છીએ. શા માટે ? એ વિષિ દ્વારા ગું થાય છે ?

એ વિષિ દ્વારા ગુરુસંતોમાં રહેલી ચેતનાને આરતીમાં પ્રગટાવેલી જ્યોતમાં હેંચી વઈ પછી પોતાના કરતલ માર્ગફન આંખો, કપાળ અને મસ્લક પર વઈ જવાની ગુરુસંતોની શક્તિને પોતાનામાં વેવાની આ અનિ ગુણ અને રહસ્યમય પદ્ધતિ છે. ગુરુજનોના આલુઓ આલુમાંથી ચેતનાશક્તિનો ધોધ બહાર પસમસનો હોય છે. સામાન્ય મનુષ્યોનાં શરીરમાંથી નેમની અનુભેતનાનો પ્રવાહ નેમના શરીરની બહાર બાર આંગળ સુધી પ્રસરેલો હોય છે. નેમ નેમ મનુષ્યની બદના ઓછી નેમ નેમ ચેતનાપ્રવાહનો પ્રસાર ઓછો. ગુરુસંતોના શરીરમાંથી તો તે પ્રવાહનું વર્તુણ ધરે દૂર સુધી પ્રસરીને ધરણ જીવોને પ્રભાવિત કરતું હોય છે. ગુરુસંતોના એકએક અંગમાંથી, એક એક રૂવાડમાંથી નેમની ચેતનાશક્તિ સંયમ, નપશર્યા, પવિત્રના અને સાચિકના રહસ્યમય સ્વરૂપે બહાર પસમસનાં હોય છે. તે પ્રવાહના સંપર્કમાં જે કોઈ આવે તે તત્પૂરતાં તો અવશ્ય બદલાઈ જાય છે. તેનું ગરું તે તાકાત નહીં કે પસમસતા પ્રવાહમાં આવીનેય યોતે ના પલટાય, અને તે અધિકારી હોય તો તો કાયમ માટે પલટાઈ જાય. સામાન્ય જિજ્ઞાસુ જેટલી ઘડી એ વર્તુણમાં રહે તેટલી ઘડી તો પવિત્ર સ્વભાવવાળો વઈ જ જાય; પછી જે મૂળ સ્વભાવમાં આવી જાય.

ગુરુજનોની ચેતના નેમની આસપાસ વર્તુળાકારે ધરે દૂર સુધી ફેલાની હોય છે. આરતી ઉત્તારતી વખતે આરતીની થાળી આપણે એ ચેતનાની વધુમાં વધુ નજીક રહીને જોળગોળ ફેરવતા હોઈએ છીએ. એ વખતે ગુરુસંતોના શરીરમાંથી નીકળતી ચેતનાઝપી જ્યોત, આરતીની જ્યોતમાં જળે છે, આકર્ષણ છે, સંગ્રહાય છે. એટલા માટે આરતી ઉત્તારવાની છે.

આજ સુધી આ રહસ્ય લાલું નહીં હોય કે હવે પછી જાણશો નહીં તમામ શાસ્ત્રોના પોથાં ઉથલાવી નાખીએ તો પણ આ રહસ્ય લાલું પણ હે નહીં. ઇતન ગુરુજનો પાસેશી જ આવી વાતો સાંભળવા મળે છે અને નેથી જ નેમની મહત્ત્વા છે.

ગુરુજનોમાં આ શક્તિ કઈ રીતે ઉત્પન્ન થતી હોય ને પણ એક અનિ ગહન વિષય છે. ધરણાં ધરણાં વર્ણોનાં ત્યાગ, નપશર્યા, અને સંયમનિયમ દ્વારા વીર્યનું ઓજ અને નેમાંથી પ્રાણ અને નેમાંથી સૂક્ષ્માનિસૂક્ષ્મ ચેતના એટલા પ્રમાણમાં એકદી વઈ જાય છે કે પછી બહાર ઊભરવા લાગે છે, રૂવાડે રૂવાડેથી બહાર નીકળવા લાગે છે. એ ચેતનાશક્તિને અધિકારી જીવો પોતાના અધિકાર દ્વારા, તો કોઈ આરતીની જ્યોત દ્વારા, તો કોઈ બીજી પુકિત-પ્રયુક્તિની જ્યોતાનામાં હેંચી વે છે. બાકીની સમાચિયેતનામાં વિલીન વઈ જાય છે.

એ ચેતના-જ્યોતને રહ્મયકુઓ જોઈ નથી શકતાં. ચેતના-જ્યોત જ્ઞાનપ્રકાશ આપે છે. તે શીતળ છે.

ઉપરોક્ત લાભ લારે જ વઈ શકાય છેકે જે ગુરુજનો શક્તિથાળી હોય. જો શક્તિન શરીરની બહાર ન નીકળતી હોય તો શક્તિ જ્યોતિમાં આવે જ કર્યાંથી ? અને તો આપણા જાયમાં પણ કર્યાંથી આવે ? કેઓ શક્તિથાળી હન તેમની જ ગરુનતરી સમાજમાં ગુરુસંતો તરીકે થતી

હતી નેવા ગુરુજનો આવે ત્યારે તેમની આરતી ઉતારીને તેમની ચેતનાનો લાભ દેવતો અને કંસીધાંસીને ભરેલા અનંત જગતોના અજ્ઞાન-અંપારાને ઉલેચવાનો પ્રયત્ન થનો. આ રીતે ગરીબ-તવંગર, વિજિત-અશીકિત, સતી-પુરુષ સર્વે, ગુરુજનો પાસેથી મળતી શક્તિની-ચેતનાની બજીથિય સહજ ભાવે અને વિના મૂલ્યે પ્રામ કરી લેતાં.

આને આ નવું રહસ્ય ખૂલ્યું. કેથી જાણવા મળ્યું કે આરતી કોની અને થા માટે ઉતારવાની છે. આજ સુધી તો આરતીની વિષિ એક જડ રિવાજ તરીકે કરતા હના આરતીથી આપણું જ લાભ છે. ગુરુજનો કાંઈ કહે છે કે અમારી આરતી ઉતારો. આરતી ઉતારનારાઓ જડ પ્રકૃતિના હોય અને બેભાનપણે આરતી ઉતારના હોય ત્યારે ધારી વાર આવું પણ બને છે.

વૈશાખ મહિનો હોય, ધોમ પદ્મના હોય, ખરા બપોરે એમના ઘેર ગ્રામ હોઈએ અને પછી ધરનાં સૌ આરતી ઉતારવા માંડે. એમને એ ખબર ના પડે કે થોડાં દૂર જાલ્યા રહીએ. જો અમારા નેવા પંચકેશવાળા કોઈ ગુરુજન હોય તો એકબે વાળ પણ એમની આરતીમાં સ્વાદ થઈ જાય. ખૂબ નાપ લાગતો હોય, ગરમીમાં રહેવાનું ના હોય અને બાજુમાં ભડકડાટ કરતી પાંચ વાટો સંજગતી હોય તેની ગરમી લાગતી હોય. બધાં સભાજનો તો દૂર બેદં હોય પરંતુ ગુરુજનોની વધુમાં વધુ નશક આરતી ફરતી હોય. ધડીમાં આંખે તો ધડીમાં નાકે નાપ લાગે. ગુરુજનો હંચણા નથી આપણા ફૂલખારોને, સત્કારને, આરતીને કે બેટને. આ બધું તો આપણે આપણા લાભ માટે કરતા હોઈએ છીએ તે ન જુલાવું હોઈએ.

આરતીની મહત્વાને સમજજા.

ગુરુસંતોની આપણે ત્યાં પથરમણી કરવીએ કે તેઓ આપણે ત્યાં આવે ત્યારે આરતીનો મોકો ખૂક્કો ન હોઈએ. આપણને આરતી ઉતારવાની હંચણ હોય પણ ગુરુજનોને તુચ્છ ના હોય, તેમને અગવડ કે કંટાળો લાગતો હોય કે તેઓ આનાકાની કરે તો એ વાતને પડી મૂકવી જોઈએ. જો સ્વીકૃતિ મળે તો અનિ સાપ્તાનીપૂર્વક, તાલબદ્ધ, પાંચ ફૂટ દૂર જાલ્યા રહીએ આરતી ઉતારવી આરતીની થાળી ગુરુજનોના મસ્તકની ઊંચાઈથી થોડે ઊંચે અને ચરણની નીચાઈથી થોડે નીચે સુધી જાય તો વધુ સારું. આરતી પાછળ ધારું મોટું વિજ્ઞાન છે.

આરતીની થાળી એકસરખી અને પદ્ધતિસર વર્તુળાકારમાં ફરતી જોઈએ તો જ તેમાં શરીરમાંથી નીકળતી ચેતના વધુમાં વધુ બળી શકે. કારણું તે પણ વર્તુળાકારે ફરતી હોય છે. બંને વર્તુળ એક થઈ જવાં હોઈએ.

પરંતુ આ બધું તો, તો જ બની શકે છે કે જો, જેની આરતી ઉતારીએ છીએ તે ચેતન્ય હોય. જડમૂર્તિમાં ચેતનાશક્તિન નથી હોની તેથી તેની આરતી ઉતારતી વખતે ઉપરોક્ત ડિયા નથી ઘટતી. જડમૂર્તિ સમજ તો બાપવાના ઉદ્ઘાસાની હોય છે. લાકડાની, પથરની, ધાતુની કે કાગળની મૂર્તિમાં ચેતન્ય નથી હોનું. નાપ, ન્યાગથી જાલસતી શક્તિ જડમૂર્તિની આરતી ઉતારવાથી નથી મળતી. જેની મૂર્તિ હોય તેના જીવનને પાદ કરીને, ભાવમય બનીને પ્રાણને ઉતેજિત કરી શકાય છે. આપણે આપણું ગુજરાન ચાવે એટલું જ જો કમાઈએ તો કોને મદદ કરી શકીએ? તો આપણે જ બીજાની આથા કરતા હોઈએ. પણ જો ભગવાનની

દ્વા થાય અને આપણે હજાર ડિપિયાના ખર્ચની સામે  
એ હજાર કુમાઈ વેતા હોઈએ તો કુટુંબને કે આદોધી-  
પાડાઠીને મદદ કરી શકીએ. હજારનો ખર્ચ હોય અને  
પચાસ હજાર કમાતા હોઈએ તો સંગ્રહલાં,  
મિત્રપરિવાર ઉપરોક્ત ઘણુંભણાંને મદદ કરી શકીએ.  
આપણી જરૂરન કરનાં ઘણું ૧૫૦ કમાતા હોઈએ તો  
બીજાને પણ લાભ મળે. આમ, આ શક્તિની વાત  
પણ એવી છે. પ્રથમ તો જેની આરની ઊનારીએ છીએ  
તેઓ શરીરધારી જીવનાંના શરીરો હોવા જોઈએ.  
નેથી જ તો અનુભવીઓએ જાણું છે કે-

પદ્ધર પૂજે હરિ મિલે, તો પૂજું મોટા પડાડ;  
મંદ્ર માલાલી હોજ રે, ગોરામ જગતા નર સેવ.

જગતા નર એટલે જીવનાં શરીરો, પદ્ધર, લોકું,  
લાકું ઈત્યાદિ કોઈ જડ પદ્ધર્ય નહીં. જગતા નર સેવ  
એટલે જીવનાં નરોની સેવા કર, જીવનાં નરોનું શરણ  
સ્વીકાર, તેની પૂજા કર, તેનો સંપર્ક રાખ. જીવના  
એટલે જગતા અને જગતા એટલે જીની. જીવના હોય  
છનાં જડ હોય, મનુષ જેવું જીવન ના જગતા હોય;  
પદ્ધુપક્ષી જેવું જીવન જીવન હોય, તો એ જગતા ના  
કહેવાય. જગતામાં બંને અર્થ સમાઈ જાય છે. જગતા  
એટલે જીવનાં અને જીનાં જેમણે જીન પ્રામ કરી લીધું  
છે અને જેમનામાંથી એ જીન શક્તિનું સ્વરૂપ પારણ  
કરી બાહાર ઊભરાઈ રહ્યું છે.

આજ સુધી અગ્રગટ રહેલી આ આરનીની વૈજ્ઞાનિક  
વિજ્ઞાની ચક્રસંશોધનાનીઓએ કરવી જોઈએ. તેઓ  
પણ તેની સત્યના કેટલી પુરવાર કરી શક્યે તે પણ  
એક કસોટી છે. આ રહસ્ય જગતને કેટલું ઉપયોગી  
થાય છે અને તેનું કેટલું કલ્યાણ કરી શકે છે એ નો  
પરમાત્મા જાણે. અસ્તુ,

## ગુરુપાદોદક પાનમ

આજચી લગભગ દસ-પંદર વર્ષ પહેલાં અમે એક  
આશ્રમમાં જયા હના તે વખતે તે આશ્રમમાં એક  
નિગ્રોભાઈ સાધક તરીકે રહેતા હના કે જેણો લાવણી  
અમેરિકામાં એક મોટા આશ્રમમાં રહે છે. તેઓ તે  
સમયે આશ્રમમાં સાધનાની નાલીમ વેતા હના. તેમને  
ખજર પડી કે પોગભિસુજ અહીં પદ્ધાર્ય છે નેથી જીજે  
દિવસે સવારે તેઓ અમને મળવા માટે આવા. અમો  
બંને એકભીજની ભાષા સમજી શકતા ન હોવાથી  
અમારી વર્ષે એક દુભાખિયા મારફત વાતો થઈ. તેમણે  
પોતાના મનની એક મૂંજવણું સમાધાન માટે અમને  
એક પ્રશ્ન કર્યો કે અહીં ભારતમાં કે આશ્રમબ્યવસ્થા  
સંયમ, નિયમ તથા આધ્યાત્મિક જ્ઞાનપ્રાપ્તિની સુવિષ્ણ  
છે તે બધું ઘણું જ ઉત્તમ, સુંદર છે. પરંતુ અહીં ગુરુદેવતનું  
ચરણમૂત્રપાન કરવાનો જે રિવાજ છે, તેની જે વિશેપતા  
છે તે અહીં તો બરાબર છે પણ અમારા અમેરિકામાં  
લોકોને આ યોગ્ય નહીં લાગે, કેમકે ત્યાંના લોકો  
કીટાળુવાદમાં ખૂબ માનનારા છે. તેઓ જેમ માને છે  
કે કોઈનો સ્પર્શ થવાથી કે કોઈની વાપરેલ ચીજાવસ્તુ  
વાપરવાથી પણ તેનામાં રહેલા રોગના જીવાનું  
આપણને લાગી જાય છે નેથી રોગના ભોગ બનાય છે  
અને આરોગ્યને નુકસાન પડોયે છે.

જ્યારે તેઓ આહી માન્યતા પરાવતા હોય લારે  
તેઓ ગુરુચરણમૂત્રનું પાન કરવા તેથાર કેમ થાય ?  
તેનો વિરોધ કરે અને તેને યોગ્ય ન ગણે ને સ્વાભાવિક  
છે. આવી માન્યતાવાળા લોકોને આ વાત હું યોગ્ય રીતે  
કેમ કરીને સમજાવી શકીય ? તે અંગે મારા મનમાં  
ખૂબ જ મૂંજવણ છે. તો તે માટે આપ મને કાંઈ  
માર્ગદર્શિન આપો.

આ નિરો સાધકભાઈની વાત સાંભળી અમે તેમને કહું કે તમો કેમની પાસે તાલીમ લઈ રહ્યા છો તેમને આ પ્રથમ પૂછવો જોઈએ. ન્યારે તેઓએ કહું કે, "ના, મારે તો આપની પાસેથી જ આ અંગે જાણવું છે." તેમની વાત સાંભળી અમે કહું કે સાંભળો-

તમારા પ્રથમાં જ ન મારો ઉત્તર આવી જાય છે. તમે કહો છો કે ગુરુચરણામૃતનું પાન કરવાની મહત્તમ અમેરિકામાં લોકો સ્વીકારે નહીં કેમકે તેઓ કીટાણુવાદમાં માનના હેવાથી એમ માને કે ગુરુચરણામૃતનું પાન કરવાથી રોગના ભોગ બની જાય. તો તે સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને તેના આપારે જ તેઓના મનનું સમાપ્તાન કરી શકાય.

રોગીજનોના સંસર્ગથી, તેની વાપરેલી વસ્તુ વાપરવાથી ને રોગીના કીટાણુ પોતાને લાગી જાય છે અને રોગના ભોગ બનાય છે તે વાત અમેરિકામાં લોકો દુદ્ધાપૂર્વક માને છે; તે વાતનો તો તમે સ્વીકાર કરો જ છો. કેમકે કોઈ ટીબીનો દર્દી હોય તો ડેક્ટર તેના કુંડભીજનોને કહે છે કે તેનાથી દૂર રહેલો, તેના સૂવાનો રૂમ અલગ રાખજો, તેની વાપરેલી ચીજાવસ્તુઓ વાપરશો નહીં. આ પ્રમાણે ડેક્ટર ખૂબ જ સાવચેતી રાખવાનું કહે છે. આમ ન કરવાથી દરદીના કીટાણુઓ

ભીજાને લાગે છે અને તે પણ તેનો ભોગ બને છે. તેવું ડેક્ટર ખૂબ જ દુદ્ધાથી માને છે. આ સિદ્ધાંતના આપારે જ ગુરુચરણામૃતની વાતને સાચી સાખિન કરી શકાય છે.

જો અનિરોગીના સંસર્ગથી કે તેની વાપરેલી વસ્તુ વાપરવાથી નેના રોગના કીટાણુ લાગી જાય અને રોગના ભોગ બની જાય તો અનિ નિરોગીના સંપર્કથી નિરોગી કેમ ન બની જાય ? ! અનિ નિરોગી, પવિત્ર, નિર્મળ, સાત્ત્વિક, સંયમી અને શ્રદ્ધેય વ્યક્તિની વાપરેલ વસ્તુમાં, કે સ્પર્શેલ પદ્ધાર્થોમાં તે વ્યક્તિને અનુભૂતિ કીટાણુ કેમ ના હોય ? હોય જ, તેથી, તેની પૂજાય અને શ્રદ્ધેય વ્યક્તિના સંસર્ગથી કે તેઓશ્રીની વાપરેલ વસ્તુ વાપરવાથી સાત્ત્વિક સહગુણોના કીટાણુ આપણુને લાગે છે અને તેથી શ્રદ્ધાય જ - લાલ જ થાય છે.

આવી શ્રદ્ધેય વ્યક્તિમાં નિર્મળ, પવિત્ર, સાત્ત્વિક, સહગુણ વિષુ માત્રામાં હોવાથી તેઓશ્રીને સ્પર્શેલ જાન લાભકારક જ હોય છે. આ રીતે આપ અમેરિકામાં માના લોકોને સમજાવી શકો છો.

આ ખુલાસો સાંભળી એ ભાઈને સંપૂર્ણ સમાપ્તાન થઈ ગયું. અમે અમેરિકા ગયેલા ન્યારે એ આશ્રમની મુલાકાત લીધીલી પરંતુ નિરોગાઈ ત્યાં લાગર નહોના અમારા વાર્તાવાપમાં ઉપરોક્ત વાતો અમે સર્વને કહી સંભળાવી અસ્તુ.

## ગુરુચરણા-રપરી-રહર્ય

સંકલન-ગૈખાય વાચ

નિયમ મુજબ, કેર્મેદાના પ્રાંગણમાં પ.પૂ. ગુરુદેવ શ્રી પોગમિશ્રુદ્ધ મહારાજ સાંજના સમયે ખુસ્લી ઉપર બેદ્ય છે. તે વખતે સાખિકા શ્રી કૃપાલને અને તેમની સાથે એક ભીજા બદેન પ્રવેશ્યા. પૂજાશ્રીને નાચયાનું કરીને બેદ્ય. સત્સંગની વાતો શરૂ થઈ. કૃપાલને પૂજાશ્રીને કહે કે-

આપ ઉધારેનને ત્યાં પાપારેલા ન્યારે મને એક દિવ્ય અનુભવ થયેલો હું આપને નમસ્કાર કરવા આવી ન્યારે મેં મારા લાયથી આપના ચરણનો સ્પર્શ કર્યો ને

પૂરા લાયમાં ગ્રસુઅણાદી ડેવાઈ ગઈ. જની વખતે ફરીને નમસ્કાર કરવા આવી ન્યારે વિચારની હતી કે એક લાયથી સ્પર્શ કર્યો તો ય આવો સુખદ અનુભવ થયો; તો જો બંને લાયથી સ્પર્શ કરું તો તો શું શું થાય ? ફરીને પણ એક લાયથી જ સ્પર્શ કર્યો."

સાંભળીને પૂજાશ્રી હસી પડ્યા. હસતાં હસતાં જ વાણીગંગા વહેવા લાગી.

(અનુસંધાન પાના નં. ૪ પર)

आश्वर का बोधक (नाम) प्रणव/ओम् है।



( सापिश देखी या गताकृत )

- (२४) कल्या, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है अत्या पुरुषविद्योग/वेतनविद्योग आश्वर है।
- (२५) आश्वर संपूर्ण सर्वज्ञ है।
- (२६) आश्वर पूर्वकाल के गुरुओं के भी गुरु है और जाल की मर्यादा से (जन्म-मृत्यु से) पर है।
- (२७) आश्वर का नाम प्रणव/ओम् है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
- (२९) चिन्तन सहित जप करने से अन्तरायों का अनाव और आत्मसाक्षात्कार होता है।

प्राप्तिकाल अमृ दर्शन, १/८, फलेश्वरगं, गरण्डुरा, ज़िलहावड-४०० ०११।

### \* इसका उद्देश्य :-

- (१) सर्वव्याप्ति परम सूक्ष्म वेतनतत्त्व के लेतुं नाम प्रणव (ओम्-ॐ) से तेनी प्रतीति अहुजन अभाजने करावा ग्रथत्व करवो। (२) 'योग'ना ग्रचार, ग्रसार अने संशोधन करावा ग्रथत्व करवो। (३) सभाजनुं नेतिके धोरण्यु धायुं लावा भाटे आध्यात्मिक ज्ञाननो साहित्य द्वारा ग्रचार अने ग्रसार करवानो ग्रथत्व करवो। (४) आ उपरांत 'अहुजनहिताय-अहुजनसुखाय' ने लगतां कार्यों लेवां के कौवाणी, तथीणी सारवार वगेरे करावा भाटे ग्रथत्व करवो।

To,



આદિસ સ્વથાપક તથા

આધ્યાત્મિક વદા પ. પુ.

ગુરુ દેવ શ્રી યોગલિંગ

PRINTED & PUBLISHED BY :-

Dr. S. S. Bhikshu for

AUMGURU PREMSAMARPANDHYANBHIKSHU PARIVAR TRUST

1/A, Palitadnagar Society, Naranpura, Ahmedabad - 380 013.

Printed at : Navprabhat Printing Press, Ahmedabad - 1.

Hon. Editor : Naishadh C. Vyas

{ (Reg. No. E/4416 Date 11-5-81)  
I.T.E.U. 80-9 NO. H.O.-II 33-11789-90 UP To March 1992 }

Pin Code

કાર્યક્રમ : ગુરુ પૂર્ણિમા  
તા. ૧૪-૭-૮૨ અ.ગાળવાડે  
હંચળગેનની વાડી, મહેનગર, અમદાવાદ.

લખાજમ દર :-

વાર્ષિક સભ્ય (ભારતમાં)	રૂ. ૧૨-૦૦
આલુવન સભ્ય	રૂ. ૨૫૦-૦૦
વાર્ષિક સભ્ય (પરદેશમાં)	૫ ડૉલર
આલુવન સભ્ય	૧૦૧ ડૉલર

\* લખાજમ મોટલવાનું સ્થળ \*

(૧) ડૉ. સોમાલાઈ એ. પટેલ

૧/અ, પદ્મિયાનગર,  
સેન્ટ કેવિયર્સ સ્ક્રેલ રોડ,  
નારથુપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

(૨) નેપથભાઈ સી. બ્યાસ

“સ્વાશ્રય” ૩, ગંગાધર સોસાયટી,  
રામભાગ પાછળ, મહેનગર,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

\* સૂચના \*

(૧) લખાજમ ચેક દારા અથવા મનીઓડર  
દારા “એ. એ. પ. ટ્રસ્ટ” ના નામે  
મોટલવું, સાથે આપણું પૂરું નામ,  
સરનામું શુદ્ધ અસ્થરોમાં લખી મોટલવું.

(૨) ને સભ્યનાં રહેઠાણનાં સ્થળ બદલાયાં  
હોય તેમણે તેમના નવા રહેઠાણનું પૂરું  
સરનામું લખી મોટલવું જેથી વ્યવસ્થા-  
પક્ષને અંક મોટલવામાં સરળતા રહે.

(૩) “રતમસાર” ને લગતો પત્રવ્યવહાર  
નીચેના સરનામે કરવો.

નેપથભાઈ સી. બ્યાસ  
“સ્વાશ્રય” ૩, ગંગાધર સોસાયટી,  
રામભાગ પાછળ, મહેનગર,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

પ. પુ. ગુરુ દેવ શ્રી યોગલિંગ સાથેનાં  
સંમરણો તથા પ્રેરક પ્રસ્તુતો આવકાર્ય છે.